

ઓનલાઈન રજિસ્ટ્રેશન સિસ્ટમ દ્વારા રાજભવનની મુલાકાત માટેની માર્ગદર્શક સૂચનાઓ:

પ્રારંભિક:

ગુજરાત રાજભવન રાષ્ટ્રીય રાજમાર્ગ-૮-અ ઉપર ગાંધીનગર ખાતે આવેલું છે. નજીકમાંથી માત્ર ૫૦૦ મીટરના અંતરેથી સાબરમતી નદી વહે છે. ગાંધીનગર ખાતે આવેલ રાજ્ય અતિથિ ગૃહની નજીકમાં મંત્રીશ્રીઓના નિવાસસ્થાનની શરૂઆતમાં રાજભવન આવેલું છે. સુંદર આનંદદાયક પ્રાકૃતિક વાતાવરણની વચ્ચે આવેલા રાજભવનની મુલાકાત એક યાદગાર અનુભવ બની રહે તેમ છે.

પ્રતિબંધિત વિસ્તાર તરીકે રાજભવન:

પરંપરાગતરીતે રાજભવનની ઓળખ માનનીય રાજ્યપાલશ્રીના રહેણાંક અને કાર્યાલય તરીકેની રહી છે. આમ રાજભવન સત્તાનું કેન્દ્ર રહેતું આવ્યું છે. સામાન્ય લોકોના મનમાં પણ રાજભવન વિષે એક અનેરો આદરભાવ રહેલો છે. રાજભવનનો વિસ્તાર ખુબજ સુદૃઢ રીતે, સુરક્ષિત કિલ્લા જેવો છે અને આમ જનતા માટે તેમાં સામાન્યતઃ પ્રવેશ કરવો એ લગભગ મુશ્કેલ ગણાય છે.

જાહેર જનતાની મુલાકાત માટે ખુલ્લું મુકવામાં આવતું રાજભવન:

વહીવટમાં પારદર્શિતાના યુગમાં સરકારની કોઈપણ સંસ્થા અને તેની કામગીરીઓ વિષે જાણવાનો સામાન્ય પ્રજાજનને અધિકાર છે. ખુદ રાજભવન પણ આમાંથી બાકાત ન રહી શકે.

લાંબા ગાળે રાજભવનને લોકભવનમાં તબદીલ કરવાની ઈચ્છા સાથે માનનીય રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલીએ જાહેર જનતા સરળતાથી રાજભવનની મુલાકાત લઈ શકે તે માટેનું આયોજન કરવાની સૂચના રાજભવન કાર્યાલયને આપી હતી. તેના પરિણામરૂપે અઠવાડિયામાં પાંચ દિવસ એટલે કે સોમવારથી શુક્રવાર દરમિયાન રાજભવનને જાહેર જનતાની મુલાકાત માટે ખુલ્લું મુકવાનો નિર્ણય લેવાયેલ છે. આ સંદર્ભમાં નીચે દર્શાવેલ માર્ગદર્શક સૂચનાઓને ધ્યાને રાખીને જાહેર જનતા રાજભવનની મુલાકાત લઈ શકશે.

માર્ગદર્શક સૂચનાઓ:

1. રાજભવનની મુલાકાત લેવાની ઈચ્છા રાખનાર વ્યક્તિઓએ રાજભવનની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ ઓનલાઇન રજિસ્ટ્રેશન સિસ્ટમ ઉપર અપાયેલા નિયત ફોર્મમાં વિગતો ભરવાની રહેશે.
2. ગુજરાત રાજભવન સોમવાર થી શુક્રવાર એમ અઠવાડિયામાં પાંચ દિવસ જાહેર રજાના દિવસો સિવાય તા. ૧ લી ઓગસ્ટ, ૨૦૧૮થી સાંજના ૫:૦૦ થી ૬:૦૦ દરમિયાન મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે. મુલાકાતીઓએ કોઈપણ સંજોગોમાં સાંજના ૬:૧૫ સુધીમાં રાજભવનની બહાર નિકળી જવાનું રહેશે.
3. રાજભવનની મુલાકાત લેવા ઈચ્છનાર વ્યક્તિઓએ તેમની મુલાકાતની તારીખના સાત દિવસ પહેલાં ઓનલાઇન સિસ્ટમથી રજૂઆત કરવાની રહેશે.
4. મુલાકાતીઓએ રાજભવનની મુલાકાત માટે પ્રવેશ દ્વાર-૨ નો ઉપયોગ કરવાનો રહેશે.
5. મુલાકાતીઓને ફાળવવામાં આવેલ સમય પહેલાં તેઓએ પ્રવેશ દ્વાર-૨ આગળ ૧૫ મિનિટ પહેલાં આવી જવાનું રહેશે. સમયસર ન આવનાર તથા મોડા પડેલ મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં.
- 6.1 રાજભવનની મુલાકાતે આવનારા ભારતીય નાગરિકોએ ફોટો ઓળખપત્ર દર્શાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન વખતે જે ફોટો ઓળખપત્ર દર્શાવેલ હશે તેજ કાર્ડથી પ્રવેશ મળી શકશે.
- 6.2 વિદેશી નાગરિકોએ તેમના કાયદેસરના પાસપોર્ટ અને વીઝાના આધાર સાથે ઓનલાઇન રજિસ્ટ્રેશન ઉપર નોંધણી કરવાની રહેશે તથા રાજભવનની મુલાકાત વખતે તેમનો મૂળ પાસપોર્ટ સલામતીદળના અધિકારીઓને ઓળખ માટે રજૂ કરવાનો રહેશે.
7. રાજભવનના સત્તાધિકારીઓ દ્વારા E-mail અગર તો SMS થી આપવામાં આવેલ પ્રત્યુત્તરના આધારે જ ઓનલાઇન બુકિંગને આખરી ગણવાનું રહેશે.

8. મુલાકાતીઓ વ્યક્તિગતરીતે અગર તો પ થી ૭ વ્યક્તિઓના સમૂહમાં રાજભવનની મુલાકાતલઈ શકશે.
9. સલામતીના કારણોસર રાજભવનની મુલાકાતે આવનાર મુલાકાતીઓને રાજભવનની મુલાકાત દરમ્યાન મોબાઇલ ફોન તથા કેમેરા સાથે લઈ જવા દેવાશે નહીં. સલામતી શાખાના કર્મચારીઓ પાસે પ્રવેશ દ્વાર-૨ ખાતે મોબાઇલ ફોન અને કેમેરા જમા કરાવવાના રહેશે તથા જમા કરાવતી વખતે ટોકન લેવાનું રહેશે.
10. સલામતીના કારણોસર કોઈપણ જાતની સ્પષ્ટતા કર્યાવગર અગર તો નકારવાના કારણો આપ્યા સિવાય રાજભવન કોઈપણ વ્યક્તિને મુલાકાત માટે પરવાનગી નકારી શકશે.
11. સલામતીના કારણોસર રાજભવન ખાતેના અતિવિશિષ્ટ મહાનુભાવોના રોકાણ દરમ્યાન જે તે દિવસના તમામ બુકિંગ રદ કરવામાં આવશે. આ સંજોગોમાં મુલાકાતની તારીખોમાં જરૂરી ફેરફાર કરવામાં આવશે.
12. રાજભવનની મુલાકાતે આવનાર મુલાકાતીઓ તેમના વાહનો પ્રવેશ દ્વાર ૨ ની સામે રાખી શકશે.
13. દરેક મુલાકાત દરમ્યાન ૫૦ જેટલા મુલાકાતીઓ રાજભવનની મુલાકાત લઈ શકશે.
14. રાજભવનની મુલાકાત માટે કોઈપણ પ્રકારની ફી નિર્ધારિત કરવામાં આવેલ નથી,અર્થાત રાજભવનની મુલાકાત વિનામૂલ્યે છે.
15. રાજભવનની મુલાકાતના સંદર્ભમાં કોઈ પણ પૂછપરછ કરવાની જરૂરિયાત જણાય તો રાજભવનના મુલાકાતીઓ માટેના મેનેજમેંટ એકમના નીચે દર્શાવેલ અધિકારીઓનો કામકાજના દિવસે બપોરે ૩:૦૦ થી ૫:૦૦ સમય દરમ્યાન સંપર્ક થઈ શકશે.

1. શ્રી બકુલ જાની,
માનનીય રાજ્યપાલશ્રીના ગૃહનિયામકશ્રી
2. શ્રી પ્રેમ વીર સિંહ, I.P.S.,
માનનીય રાજ્યપાલશ્રીના એ.ડી.સી.શ્રી
3. મેજર કે.વી.એસ. શેખાવત,
માનનીય રાજ્યપાલશ્રીના એ.ડી.સી.શ્રી

ઉપર જણાવેલ અધિકારીઓનો નીચે દર્શાવેલ ટેલેફોન નંબર ઉપરસંપર્ક સાધી શકાશે.

1. 079-232 43171
2. 079-232 43172
3. 079-232 43173

(અરવિંદ જોષી)

I.A.S. (નિવૃત્ત)

માનનીય રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ